

SARDAR PATEL UNIVERSITY
LL.B. (Special) (IInd Semester) Examination
Saturday, 1st December 2012
2.30 pm to 4.30 pm
Practical Paper-III
Alternative Dispute Resolution (Paper - IX New)

Note: Figures to the right indicate full marks.

Total Marks : 50

- Q.1 Explain the circumstances under which a foreign award become binding to the parties of Arbitration. [12]
- OR**
- Q.1 Discuss briefly the provisions regarding conduct of Arbitral proceeding. [12]
- Q.2 Examine the various stages of development of the present Arbitration Act. [13]
- OR**
- Q.2 Discuss the powers and duties of Arbitrator. [13]
- Q.3 "The Lok Adalat provide quick justice at less expenses" comment. [13]
- OR**
- Q.3 Write short notes:- [13]
- (a) Submission of statements to conciliator.
- (b) Termination of conciliation proceeding.
- Q.4 Explain **any two** :- [12]
- (a) New York convention award
- (b) Status and effect of settlement agreement
- (c) Jurisdiction of Arbitral Tribunal
- (d) Expert in Arbitration.

-: ગુજરાતી તરજૂમો :-

કુલ ગુણ: ૫૦

- પ્ર.૧ લવાઈ પક્ષકારોને વિદેશી ફેસલો કયા સંજોગોમાં બંધનકર્તા બને છે તે સમજાવો. (૧૨)
- અથવા**
- પ્ર.૧ લવાઈ કાર્યવાહીના સંચાલનને લગતી જોગવાઈઓ સંક્ષિપ્ત ચર્ચો. (૧૨)
- પ્ર.૨ વર્તમાન લવાઈ અધિનિયમના વિકાસના વિવિધ તબક્કાઓ તપાસો. (૧૩)
- અથવા**
- પ્ર.૨ લવાઈની સત્તાઓ અને કાર્યોની ચર્ચા કરો. (૧૩)
- પ્ર.૩ “લોકઅદાલત ઓછા ખર્ચે ત્વરિત ન્યાય પૂરો પાડે છે” સમાલોચના કરો. (૧૩)
- અથવા**
- પ્ર.૩ ટૂંકનોંધ લખો:- (૧૩)
- (અ) સમાધાન કર્તાને નિવેદનની સોંપણી
- (બ) સમાધાન કાર્યવાહીનો અંત
- પ્ર.૪ ગમે તે બે સમજાવો. (૧૨)
- (અ) ન્યુયોર્ક સંધિના એવોર્ડો
- (બ) સમાધાન સમજૂતિનો દરજ્જો અને પરિણામો
- (ક) લવાઈ પંચની હકુમત
- (ડ) લવાઈમાં નિષ્ણાંત

@ @ @ @ @